


સૂર્ય ઊર્જાની ખેતીમાં ઉપયોગીતા


વિષય પર ઓનલાઇન ખેડૂત તાલીમ કાર્યક્રમ

આણંદ કૃષિ યુનિવર્સિટી ની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા ખાતે “એડવાન્સડ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઓન એગ્રિકલ્ચરલ એજિનિયરિંગ બેઝ ઇન્ટરવેનશનલ પ્રોજેક્ટ અંતર્ગત રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ અને KISAN ના સંયુક્ત ઉપક્રમે “સૂર્ય ઊર્જાની ખેતીમાં ઉપયોગીતા” વિષય પર તારીખ ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ ઓનલાઇન ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી ૬૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. એચ. બી. પટેલ., વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ; ડૉ. આર. સુબ્બૈયાહ સાહેબ, આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષશ્રી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા અને કોલેજના વિવિધ વિભાગના વડાશ્રીઓ તેમજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા.

ડૉ. એચ. બી. પટેલ., વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદએ તાલીમાર્થીઓને સૂર્ય ઊર્જા નો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો અને સૂર્ય ઊર્જાની મદદથી જુદા જુદા ખેતકાર્યો કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી આપી અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. વધુમાં ઊર્જાના વિવિધ સ્ત્રોતોનો કરકસરપૂર્વક ખેતીમાં ઉપયોગની ખૂબ જ સારી સમજણપૂર્વક માહિતી આપી. ડૉ. આર. સુબ્બૈયાહ સાહેબ, આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષશ્રી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા દ્વારા ખેડૂત તાલીમાર્થીઓને ખેતીમાં સોલરથી ચાલતા જુદા જુદા ગેજેટ્સ વિષે તેમજ સૌર પમ્પ, સોલર ફ્રેસિંગ અને સોલર લાઇટિંગના ઉપયોગ વિષે અને સૂર્ય ઊર્જાથી ચાલતા સૌર સુકવણી યંત્રની મદદથી ખેતપેદાશો ની સુકવણી કરવામાં આવે છે તેની માહિતી આપી હતી.





સદર તાલીમમાં ડૉ. ડી. કે. વ્યાસ, વિભાગીય વડા (આર. ઇ. ઇ.) અને સદર યોજનાના પી. આઈ. કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા દ્વારા “સોલર પમ્પિંગ અને લાઇટિંગ સિસ્ટમ” અને ઈજ. જે. શ્રવણકુમાર, બી. ઇ. એ. એસ. વિભાગ દ્વારા “સૌર સુકવણી યંત્ર નું મહત્વ અને તેની ઉપયોગીતા” વિષય પર વ્યાખ્યાન આપ્યા. તાલીમના અંતે ઈજ. જે. શ્રવણકુમાર, બી. ઇ. એ. એસ. વિભાગ દ્વારા આમંત્રિત મહેમાનો, KISAN ના જુદા જુદા પદાધિકારીઓનો અને ખેડૂતો તેમજ આયોજકોની આભાર વિધિ કરવામાં આવી હતી.